

ખુલ્લા ઘરોમાં પ્રવેશ કરીને મોબાઇલ, લેપટોપ, પર્સ વિગેરે કિંમતી વસ્તુઓની ચોરી કરતા રીઢા ચોરને ઝડપી પાડી મોબાઇલ અને લેપટોપ ચોરીના બે ગુના શોધી કાઢતી, સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તથા વાહન ચોરી, ઘરફોડ ચોરી, સાદી ચોરી, લુંટના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા વારંવાર ગુના કરી જેલમાંથી જામીન લઇ છુટેલા આરોપીઓની હાલની પ્રવૃત્તિ બાબતે વોચમાં રહેવા કાઇમ બ્રાંચના PSD શ્રી આઇ.એસ.રબારી નાઓ તેમની ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપી- સુરેશચન્દ્ર શાંતીલાલ પિત્તલવાલા (રાણા) ઉ.વ.૫૧ રહેવાસી- ઘર નં. ૧૮૧,૧૮૨, મોઢેશ્વર મહાદેવ પોળ, ગોપીપુરા, સુરત તથા ઘર નં. ૮/૨૨૫૪/બ, સંઘાડીયાવાડ, પારસીના કુવા પાસે, ગોપીપુરા, સુરતનાને ચોરી અને છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧ સાથે ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ. તેમજ પુછપરછમાં ડીસ્કવરી પંચનામાની વિગતે એક એચ.પી. કંપનીનું લેપટોપ પણ રીકવર કરવામાં આવેલ છે.

આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા ગુના ડીટેક્ટ કરેલ છે.

(૧) ખટોદરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૪૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુન્હામાં ચોરી થયેલ મોટોરોલા કંપનીનો મોડલ નં. Moto G-6 મો.ફોન. કિં.રૂ.૧૨૦૦૦/- નો કબ્જે કરી ગુનો ડીટેક્ટ કરેલ છે. (૨) રાંદેર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ એચ.પી. કંપનીનું કાળા કલરનું લેપટોપ કિં.રૂ.૧૨૦૦૦/-નો કબ્જે કરી ગુનો ડીટેક્ટ કરેલ છે.

આરોપી અગાઉ નીચે મુજબના ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.

(૧) અડાજણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબ. (૨) ઉમરા પો.સ્ટે. ફરીયાદ નં.૦૮/૨૦૧૫ બી.પી.એક્ટ કલમ ૧૨૪ મુજબ. (૩) રાંદેર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ. (૪) અડાજણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ. (૫) કતારગામ પો.સ્ટે. ફરીયાદ નં.૧૫/૨૦૧૫ બી.પી.એક્ટ કલમ ૧૨૪ મુજબ. (૬) ખટોદરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૭૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ. (૭) રાંદેર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૯/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૮) અડાજણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૬૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.(૯) સને ૨૦૦૯,૨૦૧૩ અને ૨૦૧૬માં ત્રણ વખત પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ, અમદાવાદ અને પોરબંદર જેલમાં રહી આવેલ છે.

આરોપીની ગુન્હાની એમ.ઓ.

પકડાયેલ આરોપી સને ૨૦૦૮ થી સતત ચોરીના ગુનાઓ આચરતો આવેલ છે. અગાઉ ખુલ્લા ઘરોમાં ધુસીને તેમજ દુકાનોમાં જઇ મોબાઇલ ચોરી કરતો તેમજ વૃધ્ધ મહીલાઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચીંગ કરતો. જેમાં ઘણી વખત સુરત શહેરના ડી.સી.બી. પો.સ્ટે.માં પકડાઇ જતા તેને ચોકબજાર, ઉમરા, ખટોદરા, ઉધના, રાંદેર, અડાજણ, પુણા, કાપોદ્રા, વરાછા પોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે. જામીન ઉપર છુટ્યા બાદ આરોપી રહેણાંક સોસાયટીઓમાં આંટા-ફેરા મારી ઘરના ગેટ ખુલ્લા હોય તેવા ઘરોને ટાર્ગેટ કરી હોલમાં મોબાઇલ, લેપટોપ, પાકીટ વિગેરે જે કાંઈ કિંમતી ચીજવસ્તુ મળે તે ચુક્તિપૂર્વક ચોરી કરી, આ પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળો છે.